



# ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૬૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છષ્ટો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલથાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૯૯૯૯૯

ફેક્સ નં.૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : [info@sgcci.in](mailto:info@sgcci.in)

Website : [www.sgcci.in](http://www.sgcci.in)

Ref No. PN 2024-25/058

Dt. 12/08/2024


તંત્રીશ્રી, \_\_\_\_\_, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દેનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

દિ.

આપનો વિશ્વાસુ,

  
(અમિત પટેલ)

## SGCCI દ્વારા યાર્ન એક્ષપો દરમ્યાન 'Unlock Global Markets for Textile Materials' વિષય પર સેમિનાર યોજાયો

વક્તા શ્રી અમિત મુલાણીએ ઉદ્ઘોગ સાહસિકો અને યુવાઓને પ્રોડક્ટ અંગેનું નોલેજ મેળવી તેના વિષે એનાલાઇઝ કર્યા બાદ પ્રોડક્ટને એક્ષપોર્ટ કરવાની સલાહ આપી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા રવિવાર, તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે 'Unlock Global Markets for Textile Materials' વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં નિષ્ણાંત વક્તા તરીકે શ્રી અમિત મુલાણીએ ઉદ્ઘોગ સાહસિકોને વૈશ્વિક બજારમાં ટેક્ટાઇલ પ્રોડક્ટની એક્ષપોર્ટ માટે રહેલી તક વિષે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના માનદું ખજાનચી શ્રી મૃષાલ શુક્લએ સેમિનારમાં સર્વેને આવકાર્ય હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાયું હતું કે, યુએસએ, યુરોપ અને આફ્રિકા સહિતના ધ્યાન દેશોમાં, સુરતનું કાપક એક્ષપોર્ટ થાય છે. સુરતમાંથી કાપકનું એક્ષપોર્ટ વાર્ષિક ધોરણે આશરે ૫ બિલિયન યુએસ ડોલર છે, જે ભારતના કુલ કાપકના એક્ષપોર્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. સુરતનું ટેક્ટાઇલ સેક્ટર વાર્ષિક ૧૨થી ૧૫ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે, જે સિન્યેટિક કાપકની વૈશ્વિક માંગમાં વધારો થવાને કારણે છે. ઓંતર રાષ્ટ્રીય બજારોમાં વધતી માંગ સાથે, સુરતના ટેક્ટાઇલ એક્ષપોર્ટમાં તાજેતરના વર્ષોમાં ૧૦થી ૧૨ ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો છે. સુરત શહેર

સિન્થેટિક સાઇઓ, ફેસ મટિરિયલ્સ અને હોમ ટેક્ટાઈલનું નોંધપાત્ર એક્ષપોર્ટર છે, જેની વૈશ્વિક સ્તરે ખૂબ જ માંગ છે. સુરતમાંથી ટેકનિકલ ટેક્ટાઈલની માંગ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકા વધવાની સંભાવના છે.

શ્રી અમિત મુલાણીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી ટેક્ટાઈલ પ્રોડક્ટનું એક્ષપોર્ટ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા ૨૮૫૦૮૮ કરોડ રહ્યું હતું, જે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા ૨૯૮૨૧૧ કરોડ નોંધાયું હતું. ભારતના કુલ એક્ષપોર્ટમાં ટેક્ટાઈલ મટિરિયલ્સ તેમજ પ્રોડક્ટનું યોગદાન ૬ ટકા જેટલું છે. હવે તો વિશ્વની ઘણી કંપનીઓ ભારતથી ટેક્ટાઈલ પ્રોડક્ટ લેવા માટે આવી રહી છે. તેમણે એક્ષપોર્ટરો અને ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે, ગલોબલ માર્કેટમાં જવું હશે તો એક્ષપોર્ટ કરવા માટે સૌપ્રથમ પ્રોડક્ટ અંગે એનાલિસિસ કરવું જ પડશે. વિશ્વને હવે ચાઈના પાસેથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી નથી, આથી ભારતના ટેક્ટાઈલ ઉદ્યોગકારોને વૈશ્વિક માર્કેટમાં એક્ષપોર્ટ માટે જબરજસ્ત તકો છે.

તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં આખા વિશ્વએ રૂપિયા ૧૫૨૭.૨૦ કરોડનું મેટાલિક યાર્ન અને રૂપિયા ૧૫૦૫૩૦.૮૪ કરોડનું સિન્થેટિક ફિલામેન્ટ યાર્નનું ઇભ્પોર્ટ કર્યું હતું. આ વર્ષમાં ભારતે રૂપિયા ૫૧.૮૮ કરોડનું મેટાલિક યાર્ન અને રૂપિયા ૫૫૦૭.૪૬ કરોડનું સિન્થેટિક ફિલામેન્ટ યાર્નનું એક્ષપોર્ટ કર્યું હતું, આથી આખા વિશ્વમાં મેટાલિક યાર્ન માટે ૮૬ ટકા અને સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન માટે ૮૫ ટકા એક્ષપોર્ટની વિપુલ તકો રહેલી છે.

તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે પણ સુરતના ઈન્જાસ્ટ્રીક્યર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેથી કરીને સુરતમાં બુલેટ ટ્રેન અને હજીરા પોર્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મુંબઈમાં હવે પોર્ટનું એક્સપાન્શન શક્ય નથી. કારણ કે મુંબઈમાં હવે એક્સપાન્શન માટે જમીન રહી જ નથી, આથી સુરતમાં હજીરા પોર્ટના એક્સપાન્શન માટે વિપુલ સંભાવનાઓ છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને તેમણે ટેક્ટાઈલ મટિરિયલ્સના એક્ષપોર્ટ માટેની તકોને ઝડપી લેવા માટે તેના વિષેનું નોલેજ મેળવવા, એનાલાઈઝ કરવા અને એક્ષપોર્ટની દિશામાં આગળ વધવા માટે હાંકલ કરી હતી. તેમણે એક્ષપોર્ટ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના ગૃહ્ય ચેરમેન શ્રી કિરણ હુમરે સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની જરી કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્ર ઝડ્ફીયાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પણનાનીએ વક્તાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના સીનિયર મેનેજર શ્રીમતી સેજલબેન પંડ્યાએ ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા શરૂ કરાયેલા વિવિધ કોર્સની માહિતી આપી હતી. વક્તાશ્રીએ ઉદ્યોગ સાહસિકો અને એક્ષપોર્ટરોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.